

એસ.સી.ટી. સેલ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

માહિતીનો અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4(1)(ખ) મુજબ 17 મુદ્દાઓની માહિતી
(Pro-Active Disclosure)
(તા.01-01-2019ની સ્થિતિએ અધ્યતન કરાયેલ)

૧ જાહેર સત્તા મંડળનું વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો.

યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશન, નવી દિલ્હીની સુચના અને માર્ગદર્શન અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય, ગુજરાત યુનિવર્સિટી ભવનો, ગુજરાત યુનિવર્સિટી વિભાગો, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો, ગુજરાત યુનિવર્સિટી માન્ય અનુસનાતક કેન્દ્રો, ગુજરાત યુનિવર્સિટી માન્ય સંસ્થાઓ, ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તેમજ શૈક્ષણિક કર્મચારી તથા ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારશ્રીની અનામત નીતિના અસરકારક અમલીકરણ,

તકેદારી અને મૂલ્યાંકન ઇત્યાદી અંગે ગુજરાત યુનિવર્સિટીમાં તા. 23-02-1988થી યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશનની આર્થિક સહાયથી એસસીટી સેલની સ્થાપના થયેલ છે.

1. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કર્મચારીઓ કે વિદ્યાર્થીઓ તરફથી આવેલ લેખિત ફરજાદ અરજીની નકલ સંબંધિત ભવન, વિભાગ, સંલગ્ન કોલેજ કે માન્ય સંસ્થાને મોકલી, તેમનું વક્તવ્ય કે મતવ્ય મંગાવી જરૂરી કાર્યવાહી અને ફરજાદ નિવારણ કરવામાં આવે છે.
2. ગુજરાત યુનિવર્સિટીની અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન એસસીટી સેલ કંપલેઇન બોક્સ પણ મુકવામાં આવેલ છે. તેમાં આવતી ફરજાદોનું પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે છે.
3. યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશન તથા રાજ્ય સરકારશ્રી દ્વારા માંગવામાં આવતી વિવિધ અંકડાકીય માહિતી સંબંધિત ભવન, વિભાગ, કોલેજ કે સંસ્થાને પરિપત્રિત કરી જરૂરિયાત મુજબની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને એકત્રિત કરેલી માહિતી જરૂરિયાત મુજબ નિયત પત્રકમાં યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશન તથા રાજ્ય સરકારશ્રીને મોકલી આપવામાં આવે છે.
4. યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશન તથા રાજ્ય સરકારશ્રી તરફથી મોકલવામાં આવતા અનામત વર્ગના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને લગતાં પરિપત્ર કે ઠરાવની નકલ ગુજરાત યુનિવર્સિટી ભવન, વિભાગ, સંલગ્ન કોલેજ કે માન્ય સંસ્થાને ઘટતી કાર્યવાહી અંગે મોકલી આપવામાં આવે છે.
5. ગુજરાત યુનિવર્સિટીના મહેકમ વિભાગ દ્વારા નિભાવવામાં આવતા રોસ્ટર રજીસ્ટરની કામગીરીમાં મહેકમ વિભાગ સાથે રહીને કામ કરે છે. તેની દેખરેખ રાખવાની સમગ્ર કામગીરી સેલ દ્વારા કરવામાં આવે છે.
6. રાજીવ ગાંધી સ્કોલરશીપ અંગે ગુજરાત યુનિવર્સિટી ભવનો અને વિભાગોમાં એમ.ફીલ તથા પીએચ.ડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવે છે.
7. ગુજરાત યુનિવર્સિટી ભવન, વિભાગ, સંલગ્ન કોલેજ કે માન્ય સંસ્થામાં અનામત કક્ષાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સમયસર મળી શકે તે અંગે એસસીટી સેલ દ્વારા પરિપત્ર કરી જાણ કરવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.
8. ગુજરાત યુનિવર્સિટી ભવન, વિભાગ, સંલગ્ન કોલેજ અને માન્ય અનુસનાતક કેન્દ્રમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનામત કક્ષાની ખાલી રહેતી સીટો બિનઅનામત કક્ષાના વિદ્યાર્થીઓથી મેરિટ મુજબ ભરવા પી.જી. રૂલ અને ઓડિનન્સ-120 અન્વયે માનનીય કુલપતિશ્રીની મંજૂરી મેળવીને બિનઅનામતમાં તબદીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

9. માનનીય કુલપતિશ્રીની મંજુરીથી દરેક ઓનલાઈન પ્રવેશ સમિતિમાં એસ્સીટી સેલના પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે છે.
10. એસ્સીટી સેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોમાં યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશનના પરિપત્ર અનુસાર અનામત નિતીના ચુસ્ત પાલન માટે પરિપત્ર કરવામાં આવે છે.
11. વિવિધ કોલેજોમાં ફીશીપ કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તેંબે અભિગમ કેળવવા ફીશીપ કાર્ડ અંગે જાણકારી આપવામાં આવે છે.
12. ડિજિટલ ગુજરાત અંતર્ગત ઓનલાઈન સ્કોલરશીપ માટે ટ્રેઇનીંગ પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ, આચાર્યો અને વહીવટી કર્મચારીઓને માર્ગદર્શન મેળવે છે.
13. વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્કોલરશીપનું ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ વિનામુલ્યે ફોર્મ ભરી શકે તે માટે ફેસીલેટીવ સેન્ટર ઉભુ કરવામાં આવે છે. જેમાં યુનિવર્સિટીના વિવિધ ભવનો, વિભાગો તથા સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ લાભ લે છે.
14. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ય ઓનલાઈન સ્કોલરશીપનો લાભ વિદ્યાર્થીઓ મેળવ્યો શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
15. વિવિધ પ્રકારની ઓનલાઈન સ્કોલરશીપમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન વેરીફિકેશન, વિદ્યાર્થીઓની વિવિધ વિગતોની ખરાઈ તથા આનુસારિક પ્રક્રિયા કરવામાં આવે છે.
- 2 અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો.
- ગુજરાત યુનિવર્સિટી એક્ટ-1949, સ્ટેચ્યુટ્સ, ઓડિનન્સ, રૂલ્સ તથા રેગ્યુલેશન મુજબ.
- 3 દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાંઈસીતિ.
- ગુજરાત યુનિવર્સિટી એક્ટ-1949, સ્ટેચ્યુટ્સ, ઓડિનન્સ, રૂલ્સ તથા રેગ્યુલેશન મુજબ.
- 4 કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો.
- ગુજરાત યુનિવર્સિટી એક્ટ-1949, સ્ટેચ્યુટ્સ, ઓડિનન્સ, રૂલ્સ તથા રેગ્યુલેશન મુજબ.
- 5 કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપરોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહો અને રેકડ.
- ગુજરાત યુનિવર્સિટી એક્ટ-1949, સ્ટેચ્યુટ્સ, ઓડિનન્સ, રૂલ્સ તથા રેગ્યુલેશન મુજબ.
- 6 પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક.
- | ક્રમ | દસ્તાવેજની કક્ષા | દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ | દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ | નીચેની વ્યક્તિને પાસે છે/તેના નિયંત્રણમાં છે |
|------|------------------|---|--|--|
| 1 | વિભાગીય કક્ષા | ઠરાવો, પરિપત્રો તથા ફાઈલો | એક્ટ હેઠળના નિયમો મુજબ હોય તો અન્યથા વિનંતીથી. | શાખા અધિકારી |
- 7 તેની નીતિ ઘન્યતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સમ્બોદ્ધ વિચારવિનિયમ માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો.
- ગુજરાત યુનિવર્સિટી એક્ટ-1949, સ્ટેચ્યુટ્સ, ઓડિનન્સ, રૂલ્સ તથા રેગ્યુલેશન મુજબ.
- 8 તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી બધું વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોધો લોકોને મળવાપાત્ર છે કે કેમ.
- ગુજરાત યુનિવર્સિટી એક્ટ-1949, સ્ટેચ્યુટ્સ, ઓડિનન્સ, રૂલ્સ તથા રેગ્યુલેશન મુજબ.
- 9 તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા.

ક્રમ	નામ	હોદ્ડો	સંપર્ક નંબર (કોરેટી)	સરનામું
1	શ્રી આર.જે. પટેલ	નાયબ કુલસચિવ	26301233	એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ
2	ખાલી	શાખા અધિકારી	26301233	એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ
3	શ્રી રીના આર. જૈન	સ્ટેટીસ્ટીકલ આસ્ટિન્ટ (ફિક્સ પે)	26301233	એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ
4	ખાલી	કલાર્ક	26301233	એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ
5	ખાલી	સ્ટેનોગ્રાફર- કમ-ડેટા એન્ટ્રી ઓપરેટર	26301233	એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ
6	શ્રી રજનીકાંત એમ. પારદ્ધી	પ્યુન	26301233	એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ

આ ઉપરાંત બે હંગામી જોબ ટ્રેઇનીંગ પણ કાર્યરત છે.

- 10 તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મહેનતાણા.

ક્રમ	નામ	હોદ્ડો	માસિક મહેનતાણું	વળતર/ વળતર ભથ્થું	વિનિયમમાં જણાવ્યા મુજબ મહેનતાણું નક્કી કરવાની કાર્યપદ્ધતિ
1	શ્રી આર.જે. પટેલ	નાયબ કુલસચિવ	રૂ.99500 બેઝિક	-	નિયમ મુજબ
3	શ્રી રીના આર. જૈન	સ્ટેટીસ્ટીકલ આસ્ટિન્ટ (ફિક્સ પે)	રૂ.31340 (ફિક્સ પે)	-	નિયમ મુજબ
6	શ્રી રજનીકાંત એમ. પારદ્ધી	પ્યુન	રૂ.31100 બેઝિક	-	નિયમ મુજબ

આ ઉપરાંત બે હંગામી જોબ ટ્રેઇનીંગને દરેકને ઉચ્ચક રૂ.10000 પ્રતિ માસ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચુકવવામાં આવે છે.

- 11 તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને ચુકવેલા નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક અજન્સીને ફાળવેલ અંદાજપત્ર.

- એસ.સી.ટી. સેલ હસ્તક આવી કોઈ કામગીરીનું અમલીકરણ થતું ન હોઈ આવી કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવાની થતી નથી.
- 12 કાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલબજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો.
- એસ.સી.ટી. સેલ હસ્તક આવી કોઈ કામગીરીનું અમલીકરણ થતું ન હોઈ આવી કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવાની થતી નથી.
- 13 તેણે આપેલ છટઘાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો.
- એસ.સી.ટી. સેલ હસ્તક આવી કોઈ કામગીરીનું અમલીકરણ થતું ન હોઈ આવી કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવાની થતી નથી.
- 14 ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો.
- એસ.સી.ટી. સેલ હસ્તક આવી કોઈ યોજનાઓનું અમલીકરણ થતું ન હોઈ આવી કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવાની થતી નથી. તેમ ઇતાં એસ.સી.ટી. સેલની કામગીરીની વિગતો મુદ્દા નં.-૧માં આપેલ છે.
- 15 જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા ગ્રંથાલય અથવા તેના વાચનકષણના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો.
- એસ.સી.ટી. સેલ દ્વારા કોઈ ગ્રંથાલય અથવા વાચનકષણ નિભાવવામાં આવતા ન હોઈ આવી કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવાની થતી નથી.
- 16 એસ.સી.ટી. સેલના જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદા અને બીજી વિગતો.
- શ્રી આર.જે. પટેલ, નાયબ કુલસચિવ, એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિફોન નં. ૦૭૯-૨૬૩૦૧૨૩૩
- 17 અન્ય ઉપયોગી માહિતી:
1. માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (ગુજરાતી)
 2. ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, ૨૦૧૦ (ગુજરાતી)
 3. ગુજરાત યુનિવર્સિટી વેબસાઇટ
 4. જાહેર સત્તા મંડળનું નામ તથા સરનામું: એસ.સી.ટી. સેલ, મનોવિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિફોન નં. ૦૭૯-૨૬૩૦૧૨૩૩
 5. અરજીપત્રકની ઝીઃ ૩. ૨૦/- (અંકે રૂપિયા વીસ પુરા)
 6. અરજીપત્રક: અરજીપત્રકનું ફોર્મેટ નીચે મુજબ છે.
 7. માહિતી મેળવવા માટેની અરજી કેવી રીતે કરવી: કાયદા હેઠળ રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલા નિયમોમાં સુચય્યા મુજબ અરજી કરવી.
 8. માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવા વખતે નાગરિકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી:
- કાયદા હેઠળ રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલા નિયમોમાં સુચય્યા મુજબ નિયત સમય મર્યાદા રાને તેના ફોર્મેટમાં અપીલ અરજી કરવી. (અરજીપત્રકનું ફોર્મેટ નીચે મુજબ છે.)

પ્રથમ અપિલીય અધિકારી:

ડૉ. પી.એ.મ. પટેલ, પ્રથમ અપિલીય અધિકારી અને કાર્યકારી કુલસચિવશ્રી, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિફોન નં. ૦૭૯-૨૬૩૦૧૩૪૧.

પ્રથમ અપીલમાં મળેલ નિર્ણયથી અસંતુષ્ટ નાગરિક બીજુ અપીલ ગુજરાત માહિતી આયોગમાં કરી શકે છે. (અરજીપત્રકનું ફોર્મેટ નીચે મુજબ છે.)